

ત્વરિત જાહેરાત માટે

પ્રાંતની પ્રાદેશિક સરકારની સમીક્ષામાં પોતાનો અભિપ્રાય આપો

બ્રમ્પટન, ઓન્ટારિયો (05 એપ્રિલ 2019) – સીટી ઓફ બ્રમ્પટન પોતાના નાગરિકોને આલ્વાન આપે છે કે આ વસંત ઋતુમાં થનાર [પ્રાદેશિક સરકારની સમીક્ષા](#) પર પોતાનો પ્રતિભાવ અને મત દર્શાવે.

આ વર્ષનાં પૂર્વાર્ધમાં ઓન્ટારિયો પ્રાંત દ્વારા પ્રાદેશિક સરકારોની સમીક્ષા કરવાનો પ્રારંભ થયો જેથી સુનિશ્ચિત કરી શકાય કે નગરપાલિકાઓ અને પ્રાદેશિક સરકારો સંભવ હોય એટલા સરકારક રીતે કાર્ય કરી રહ્યા છે અને સમાજ જેના પર આધાર રાખી શકે એવી મહત્વની સેવાઓ આપવી ચાલુ રાખી શકે.

આ સમીક્ષાના પરિણામોથી રિજન ઓફ પીલનાં પ્રશાસનિક માળખા પર પ્રભાવ પડી શકે જેમાં બ્રમ્પટન, મિસિસોગા, ટાઉન ઓફ કેલેડન જેવા શહેરો સમાયેલા છે.

પોતાનો મત દર્શાવો

નગરપાલિકાઓ અને નાગરિકો પોતાનો મત ઘણી બધી રીતે પ્રાંત દ્વારા કાર્યરત જાહેર પરામર્શો મે 21 ના રોજ સમાપ્ત થાય ત્યાર પહેલા જાણાવી શકશે.

1. વિશિષ્ટ સલાહકારોને રૂબરૂ મળો

વ્યક્તિઓ તેમજ સંગઠનો સમીક્ષા માટેના વિશિષ્ટ સલાહકારો સાથે રૂબરૂ વાત કરવાની વિનંતી રજૂ કરી શકે છે. સલાહકારો તમને મોઢેમોઢ સાંભળે એવી આ તક છે - એટલેકે એવા લોકો જેઓ સમીક્ષા દ્વારા આવરિત નગરપાલિકાઓમાં સમય વિતાવતા હોય, કામ કરતા હોય અને રહેતા હોય.

જગ્યાઓ સીમીત છે અને [વાત કરવાની રજૂઆતો](#) ફક્ત એપ્રિલ 3 થી એપ્રિલ 9 સુધી ખુલ્લી છે. બ્રમ્પટનનો આ પ્રસંગ 08 મે 2019ના રોજ રિજન ઓફ પીલ ખાતે ગોઠવાયેલ છે (10, પીલ સેન્ટર ડ્રાઈવ, બ્રમ્પટન).

2. લેખિત રજૂઆત મોકલો

પ્રાંત એટલેકે પ્રોવિન્સ લેખિત રજૂઆતો [ઈમેલથી અથવા પત્રથી](#) પણ સ્વીકારે છે.

3. ઓનલાઈન સર્વેક્ષણ પૂર્ણ કરો

તમે પ્રાંતનું [સર્વેક્ષણ](#) ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો.

સીટી ઓફ બ્રમ્પટનની સરખામણીએ રિજન ઓફ પીલ કઈ સેવાઓ આપે છે?

સીટી ઓફ બ્રમ્પટન અને રિજન ઓફ પીલ મનોરંજક કાર્યક્રમોથી માંડીને કચરો એકઠો કરવા સુધીની સંખ્યાબંધ અનિવાર્ય સેવાઓ આપે છે. કોણ શું કરે છે તેની સરળ સૂચી માટે [આ લિંક જુઓ](#).

પ્રાદેશિક સરકારની સમીક્ષા અંગે સીટી શું કરી રહ્યું છે?

ઘણા સમયથી સીટી ઓફ બ્રમ્પટન રિજન ઓફ પીલ ખાતે [નિષ્પક્ષ પ્રતિનિધિત્વની](#) ભલામણ કરી રહ્યું છે તેમજ બ્રમ્પટન નિવાસીઓને પ્રભાવિત કરતા નિર્ણયો લેવાય છે તે મંચ પર બુલંદીથી અવાજ ઉઠાવી રહ્યું છે. કર્મચારીઓ એપ્રિલ માસમાં કાઉન્સિલને અહેવાલ સૂપ્રત કરશે. આગામી બે મહિનાઓમાં વધુ જાહેર પરામર્શની તકો ઉપલબ્ધ થશે. વધુ અપડેટ્સ માટે સીટીની વેબસાઈટ અને સોશયલ મિડિયા ચેનલો મારફત જોડાયેલા રહેશો.

-30-

સીટી ઓફ બ્રમ્પટન વિશે વિષે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca અમને ફોલો કરો [Twitter](#) પર, [Facebook](#) પર, અને [Instagram](#) પર.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca